



# LOYAL Equipments limited.

Regd. Office & Works : Block No.: 33/34/35/1-2-3-4-5, Village : Zak,  
Ta.: Dahegam, Dist : Gandhinagar - 382 330, GUJARAT, INDIA  
Contact No.: +91 90990 39955  
E-mail : Info@loyalequipments.com, www.loyalequipments.com  
CIN NO. L29190GJ2007PLC050607

ISO 9001 : 2015 Certified  
ASME - U, U2, R & NB Certified

Date: November 02, 2021

To,

The Compliance Department,  
B.S.E. Ltd.,  
P.J. Towers, Dalal Street,  
Fort, Mumbai-400 001,  
Maharashtra, India.

**(Ref.: Loyal Equipments Limited, Scrip Code: 539227, Security ID: LOYAL)**

**Sub: Submission of Board Meeting Notice of the Company published in the Newspapers.**

Respected Sir/Madam,

With reference to the above subject and in pursuance of Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are submitting herewith the copies of the Notice of Board Meeting of the Company as published in Financial Express (All India English Edition) and Financial Express (Gujarati Edition) on November 02, 2021.

You are requested to kindly take the same on record and inform all those concerned accordingly.

Thanking you,

Yours faithfully,

For Loyal Equipments Limited

  
Alkesh Rameshchandra Patel  
Managing Director  
DIN-02672297



Place – Dahegam, Gujarat

Encl: As above



### CIAN HEALTHCARE LIMITED

Address: MILKAT NO.3339, BLOCK NO.1, FROM SOUTH SIDE, C.S. NO. 227/2+3A, HARPALE PARK, OPP. BERGER PAINT, PHURSUNGI PUNE MH 412308 IN

#### NOTICE OF EOGM, REMOTE E-VOTING AND DISPATCH OF NOTICE

NOTICE is hereby given that 2nd EXTRA ORDINARY GENERAL MEETING (EOGM) FOR FY 2021-22 of the members of CIAN HEALTHCARE LIMITED (Formerly known as CIAN HEALTHCARE PRIVATE LIMITED) will be held on Wednesday 24th day of November, 2021 at 09:00 am. at MILKAT NO.3339, BLOCK NO.1, FROM SOUTH SIDE, C.S. NO. 227/2+3A, HARPALE PARK, OPP. BERGER PAINT, PHURSUNGI PUNE MH 412308 IN to transact the business as set out in EOGM Notice:

- The Company is providing remote e-Voting facility to its member holding shares on November 18, 2021 being cut-off date to exercise their vote through electronic means.
- Remote e-Voting commences on Saturday November 20, 2021 (10:01 am) and ends on Tuesday November 23, 2021 (05:00 pm). And e-Voting shall not be allowed beyond 05:00 pm on November 23, 2021.
- The Company has engaged National Securities Depository Limited (NSDL) to provide remote e-voting facility and facility for voting through ballot paper shall be made available at the EOGM.
- Any person who acquires shares and becomes a member of the Company after dispatch of the Notice and holding shares as on cut-off date, can do remote e-Voting as provided in by obtaining User ID and password by sending mail to evoting@nsdl.co.in or saritaM@nsdl.co.in. However if such shareholder is already registered with NSDL for remote e-Voting then existing user ID and password can be used for casting your vote.
- The Notice of EOGM is also available on website of company www.cian.co and on NSDL www.e-voting.nsdl.com.
- In case you have queries or issue regarding remote e-voting you may contact Ms. Sarita Mote, Ass. Manager 4th Floor, "A" Wing, Trade World, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel Mumbai 400013 saritaM@nsdl.co.in. IN Tel: 022-24994200/4545.
- Notice of EOGM has been dispatched by post or e-mail to all the respective shareholders at their registered address.
- In case you have queries or issue regarding remote e-voting you may contact Ms. Sarita Mote, Ass. Manager 4th Floor, "A" Wing, Trade World, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel Mumbai 400013 saritaM@nsdl.co.in. IN Tel: 022-24994200/4545.

Date: 01/11/2021

Place: Pune  
By order of the Board  
Manjaji Dhumal  
Company Secretary & Compliance Officer

### Indian Bank

Information Technology Department,  
Corporate Office, Chennai

Indian Bank, a leading Public Sector Bank, is interested in:

- Procurement, Installation, Configuration, Testing, Commissioning, Warranty and Maintenance of 2300 Numbers of SD-WAN (Software Defined Wide Area Network) Enabled Routers with Licenses.
- Procurement and Implementation of Internal and External Firewalls at Head Office and Corporate Office.

Interested parties may refer Bank's Website:  
<https://www.indianbank.in/tenders>  
for details.

Place: Chennai  
Date: 01.11.2021

### INDRAPRASTHA MEDICAL CORPORATION LIMITED

Regd. Office: Sarita Vihar, Delhi-Mathura Road, New Delhi - 110 076 (India)  
Corporate Identity Number: L24232DL189PLC03958  
Phone: +91-11-26955858, 26955801, Fax: +91-11-26823829  
E-mail: imcl@apollohospital.com, Website: delhi.apollohospital.com

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given, that a meeting of the Board of Directors of the Company will be held on **Tuesday, 9th November, 2021**, to consider and approve, the unaudited financial results for the quarter and half year ended **30th September, 2021**.

The above information is also available on the website of the Company i.e. <https://delhi.apollohospital.com> and on the website of the stock exchanges i.e. on [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com)

**New Delhi**  
**01.11.2021**  
**Priya Ranjan**  
**AVP – Corporate Affairs & Legal**

Place: New Delhi  
Date: 01.11.2021

### ICEX

Indian Commodity Exchange Limited  
Corp Office: Reliable Tech Park, 403-A, B-Wing, 4th Floor, Thane - Belapur Road, Airoli, New Mumbai - 400708, India.  
CN: U67120GJ2008PLC09942 Email: membership@icexindia.com Contact no: +91 22 40381500

#### PUBLIC NOTICE

Notice is hereby given that the following member of Indian Commodity Exchange Limited (ICEX) has applied for Surrender of its Trading Membership (TM).

| Member ID | Member Name   | SEBI Registration No. |
|-----------|---|-----------------------|
| 2068      | Econo Broking Private Limited (Formerly known as Bansal Contrade Private Limited) | INZ000056334          |

Any Client/person having any claim/dispute/grievance against above member arising out of transactions in Commodities Derivatives through ICEX, may furnish details of their claim in prescribed form available on Exchange web site <https://www.icexindia.com/grievance/grievance/register-a-complaint-offline> to Investor Grievance Department of the Exchange (ICEX) at the address given above, enclosing therewith all supporting documents, within 60 days of the publication of this notice. Any claims received thereafter shall not be entertained by the Exchange.

Place: Mumbai  
Date: November 01, 2021  
For, Indian Commodity Exchange Limited.  
Sd/-  
Authorised Signatory

### LOYAL equipments limited

(CIN: L29190GJ2007PLC05607)  
Regd. Office: Block No. 35/1-2-3-4, Village-Zak, Dahegam, Gandhinagar-382330, Gujarat, India. Tel No.: +91-2718-247236, Fax No.: +91-2718-269033  
E-mail: cs@loyalequipments.com, Website: www.loyalequipments.com

#### NOTICE

Notice is hereby given that pursuant to Regulation 29 & 33 read with Regulation 47 and other applicable regulations of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a meeting of the Board of Directors of Loyal Equipments Limited is scheduled to be held on Friday, November 12, 2021 at 2.00 PM, at the registered office of the Company situated at Block No. 35/1-2-3-4 Village-Zak, Dahegam, Gandhinagar-382330 Gujarat, India, inter-alia to consider and approve the Un-audited Standalone and Consolidated Financial Results of the Company for the quarter and half year ended on September 30, 2021 and to take on record Limited Review Report thereon. The said notice may be accessed on the Company's website at [www.loyalequipments.com](http://www.loyalequipments.com) and also on the website of BSE Limited at [www.bseindia.com](http://www.bseindia.com).

For, Loyal Equipments Limited  
Sd/-  
**Alkesh Rameshchandra Patel**  
Managing Director  
DIN-02672297

Place: Dahegam, Gujarat  
Date: 01.11.2021

### DELHI JAL BOARD: GOVT OF NCT OF DELHI

#### OFFICE OF THE EXECUTIVE ENGINEER (E&M)-II

WAZIRABAD WATER WORKS, CIVIL LINES, TIMARPUR DELHI-110054  
"STOP CORONA; Wear Mask, Follow Physical Distancing, Maintain Hand Hygiene"

#### Press Nit No-23(2021-22)

| SIT No.   | Name of Work  | Estimated Cost | Earnest Money (Rs.) | Date of release of Tender in e-procurement solution        | Last date/time of receipt of Tender through e-procurement solution |
|---|---|----------------|---------------------|--|--|
|   |   |                |                     |  |  |
| 1   | Operation and Minor maintenance for 88 No. Tube Wells (old) and 4 Nos. Rammed Walls at Palla Area. (Re-Invited) | Item Rate      | Rs. 2,85,500/-      | 2021_DJB_210442_1 Publish Date 29-Oct-2021 06:55 PM onward | 25-Nov-2021 up to 03:15 PM   |
| Exempted duty office memorandum no: F-94/2020-PPD and DJB Memorandum No: DJB/2020-21/Misc-IIP/7/971 Dated: 23.12.2020 |   |                |                     |  |  |

NIT along with all terms & conditions is available on DJB website <https://govtprocurement.delhi.gov.in>

ISSUED BY P.R.O. (WATER)  
Advt. No. J.S.V. 547/2021-22

EXECUTIVE ENGINEER (E&M)-II

### NIRMAL BOT LTD

CIN: L45201MH2006PLC164728  
Registered Office: 316-317, C Wing, Kanakia Zillion, LBS Road, BKC Annex, Kurla (west), Mumbai - 400070  
Tel: +91 22 61073200 • Fax: +91 22 61073201 • Web: www.nirmalbot.com

#### Unaudited Financial Results for the quarter ended September 30, 2021

| Sl. No. | Particulars  | Quarter ended (Rs. In Lacs) |                       |
|---------|--|-----------------------------|-----------------------|
|         |  | 30.09.2021<br>Unaudited     | 31.03.2021<br>Audited |
| 1       | Total Income from Operations   | 682.40                      | 8,035.50              |
| 2       | Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)  | (1,175.60)                  | 1,562.70              |
| 3       | Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)   | (1,175.60)                  | 1,562.70              |
| 4       | Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)  | (1,116.08)                  | 1,280.91              |
| 5       | Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | (1,115.46)                  | 1,281.88              |
| 6       | Paid up Equity Share Capital   | 3,150.00                    | 3,150.00              |
| 7       | Reserves (excluding Revaluation Reserve)   | (1,259.40)                  | (222.90)              |
| 8       | Net worth  | 1,890.60                    | 2,927.10              |
| 9       | Paid up Debt Capital / Outstanding Debt  | 13,366.00                   | 14,201.00             |
| 10      | Debt Equity Ratio  | 2.12                        | 2.25                  |
| 11      | Earnings Per Share (of Rs. 10/- each)  |                             |                       |
|         | 1. Basic:  | (3.54)                      | 4.07                  |
|         | 2. Diluted:  | (3.54)                      | 4.07                  |
| 12      | Debt Equity Ratio  |                             |                       |
| 13      | Debt Service Coverage Ratio  | 0.97                        | 1.04                  |
| 14      | Interest Service Coverage Ratio  | 0.97                        | 1.89                  |
| 15      | Assets Coverage Ratio  | 1.38                        | 1.43                  |
| 16      | Current Ratio  | 2.03                        | 3.83                  |
| 17      | Long Term Debt to Working Capital Ratio  | 0.84                        | 0.81                  |
| 18      | Total Debts to Total Assets  | 0.17                        | 0.16                  |
| 19      | Current Liability Ratio  | 3.09                        | 27.55                 |
| 20      | Debtors Turnover   | NA                          | NA                    |
| 21      | Bad Debts to Account Receivable Ratio  | NA                          | NA                    |
| 22      | Inventory turnover *   | NA                          | NA                    |
| 23      | Operating Margin %   | 57%                         | 27%                   |
| 24      | Net profit Margin%   | -163%                       | 16%                   |

Notes to Unaudited Financial Results for the quarter ended 30th September, 2021  
1 The above is an extract of the detailed format of quarter and half-year ended financial results filed with the stock exchange in accordance with Regulation 52 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (the "Listing Regulations, 2015"), as amended and the Accounting Standards specified under Section 133 of the Companies Act, 2013 readwith the Companies (Indian Accounting Standards) Rule, 2015 as amended and the relevant provisions of the Companies Act, 2013, as applicable. The full format of quarter and half-year ended financial results are available on the website of the stock exchange BSE Limited ([www.bseindia.com](http://www.bseindia.com)) and the Company's website ([www.nirmalbot.com](http://www.nirmalbot.com)).

2 The above financial results of the Company are reviewed and recommended by the Audit Committee and have been approved by the Board of Directors of the Company at their respective meeting held on 01st November, 2021.

3 For the other line items referred in regulation 52 (4) of the Listing Regulations, pertinent disclosures have been made to the Stock Exchange - BSE Limited ([www.bseindia.com](http://www.bseindia.com)) and can be accessed on the Company's website ([www.nirmalbot.com](http://www.nirmalbot.com)).

4 The definitions of ratio / formulas used for actual computation are as follows: Debt Equity Ratio = Total Debt by way of NCDs / Equity (Incl. Quasi Equity in the form of Promoter's Contribution) Debt Service Coverage Ratio = (Profit before Interest, Depreciation and Tax) / (Interest on NCDs + Principal Repayment of NCDs) Interest Service Coverage Ratio = (Profit before Interest, Depreciation and Tax) / (Interest). Asset Coverage Ratio = (Total Assets-Intangible Assets)-(Current Liabilities-Short term debt)/Total Debt Obligation. Current Ratio = Total Current Assets / Total Current Liabilities. Long Term Debt to Working Capital Ratio = Non Current Borrowings (including Current Maturities of Long Term Debt) / (Current Assets Less Long Term Liabilities excluding current Maturity of Non Current Borrowings) Total Debts to Total Assets Ratio = Total Debt / Total Assets. Current Liability Ratio = Total Current Liabilities / Total Assets. Debtors Turnover = Revenue from Operations / (Trade Receivable + Annuity receivable) classified under Other Financial Assets) Operating Margin % = (Earnings before Interest, Tax and Exceptional items - Other Income) / Revenue from Operations \* 100 Net Profit Margin % = Profit After Tax/Total Revenue \* 100 \* There is no bad debts and inventory in the company. Hence, Bad Debts to Account Receivable Ratio and Inventory Turnover ratios are not applicable to Company. Previous year figures have been re-grouped, re-worked and re-classified wherever necessary, to make them comparable with current year/period figures.

For and on behalf of the Board of Directors  
Nirmal BOT Limited  
Narayana Doraiswamy  
Director  
DIN: 03169791

Place: Mumbai  
Date: 1st November, 2021

### PI Industries Limited

CIN: L24211RJ1946PLC000469  
Regd. Office: Udaisaroad Road, Udaipur - 313 001 (Raj.)  
Ph: 0294-6651100, Fax: 2491946  
E-mail: investor@piind.com, Website: www.piindustries.com

#### NOTICE TO EQUITY SHAREHOLDERS OF THE COMPANY

TRANSFER OF EQUITY SHARES TO INVESTOR EDUCATION & PROTECTION FUND

This Notice is published pursuant to the provisions of the Companies Act, 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Amendment Rules, 2017 ("the Rules") read with Section 124(6) of the Companies Act, 2013 ("the Act").

The Equity Shareholders of PI Industries Limited ("the Company") are hereby informed that in accordance with the provisions of section 124(6) of the Act read with Rule 6 of the Rules, all shares in respect of which unclaimed dividend has been transferred to Investor Education and Protection Fund ("IEPF") under the Act and the Rules and in respect of which any dividend warrant has not been en-cashed by the shareholder(s) during last seven consecutive years or more (relevant shares), shall be transferred and credited by the Company to the Demat account of IEPF in the manner prescribed under the Rules.

Accordingly dividend declared by the Company during financial year 2014-15 (Interim Dividend 2014-15) lying unpaid / unclaimed for a period of seven consecutive years or more as on December 3, 2021 will be transferred to IEPF. Further, shares held by the shareholders who have not en-cashed the dividend for the year 2014-15, and who have not en-cashed any dividend warrant during last seven years, will also be transferred to IEPF under the Act and the Rules. Details of such dividend and shares transfer are available on the website of the Company viz. <http://www.piindustries.com/investor-relations>. All benefits accruing on such shares, if any, shall also be transferred to IEPF in compliance of the Rules. The shareholders may claim the share transferred to IEPF along with benefits accrued thereon, from time to time, after following the procedure laid down in the Rules. Please note that no claim shall lie against the Company with respect to the unclaimed / unpaid dividends and share(s) transferred to the IEPF pursuant to the Rules. The Company has communicated by email to those shareholders whose shares are liable to be transferred to IEPF under the said Rules and whose email address is available and also sent intimation to non email ID holders by post.

In case the shares which are required to be transferred to IEPF are held in physical form, the Company would be issuing duplicate share certificate(s) for transferring to IEPF and upon issue of such duplicate share certificates, the original share certificate(s) will be deemed to be cancelled and non-negotiable. In case the shares are held in demat form, the Company shall inform the depository by way of corporate action, where the Shareholders have their demat accounts, for transfer of shares to IEPF.

In order to enable sending of notices and other statutory communications/benefits to shareholders in electronic form, we request the shareholders of the Company, who have not yet registered their e-mail address, PAN No. and bank account details, to register the same in respect of equity shares held in electronic form with the concerned Depository through their Depository Participant(s) and in respect of shares held in physical form by writing to the Company and its Registrar and Share Transfer Agent M/S Kfintech Technologies Pvt. Ltd. (Unit: PI Industries Ltd.), Karvy Selenium Tower B, Plot 31-32, Gachibowli, Financial District, Nanakramguda, Hyderabad - 500 032. Attn: Mr. N. Shiva Kumar, Toll Free No.: 1800-4258-998. Email: [enward.ris@kintech.com](mailto:enward.ris@kintech.com); website: [www.kintech.com](http://www.kintech.com)

In case the Company does not receive any communication from the concerned shareholders by November 25, 2021 or such other date as may be extended, the Company shall, with a view to complying with the requirements set out in the Rules, dematerialise and transfer the shares to IEPF Authority by way of corporate action by the due date as per procedure stipulated in the Rules.

For PI Industries Limited  
Sd/-  
**Narish Kapoor**  
Company Secretary

Place: Gurugram  
Date: 01.11.2021

### IP Rings Ltd.

(A member of the Amalgamations Group)  
Regd. Office: D-11/12, Industrial Estate, Maraimalai Nagar - 603 209.  
Phone: 044 - 27452851, email: investor@iprings.com Website: www.iprings.com  
CIN: L28920TN1991PLC020232

#### STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS

#### FOR THE QUARTER AND SIX MONTHS ENDED SEPTEMBER 30, 2021

(₹ in lakhs)

| Sl. No. | Particulars   | Quarter Ended |            | Half Year Ended |            | Year Ended<br>31.03.2021 |
|---------|---|---------------|------------|-----------------|------------|--------------------------|
|         |   | 30.09.2021    | 30.06.2021 | 30.09.2021      | 30.09.2020 |                          |
|         |   | Unaudited     | Unaudited  | Unaudited       | Unaudited  |                          |
| 1       | Total Income from Operations  | 6,644.47      | 6,283.48   | 4,629.89        | 12,927.95  | 19,946.01                |
| 2       | Net Profit / (Loss) for the period (before tax and exceptional items)   | 52.87         | 566.40     | 258.34          | 619.27     | (453.89)                 |
| 3       | Net Profit / (Loss) for the period before tax (after exceptional items)   | 52.87         | 566.40     | 258.34          | 619.27     | (453.89)                 |
| 4       | Net Profit / (Loss) for the period after tax (after exceptional items)  | 28.86         | 404.53     | 185.68          | 433.39     | (328.41)                 |
| 5       | Total comprehensive income for the period (comprising profit/ (loss) for the period (after tax) and other comprehensive income (after tax)) | 15.04         | 390.82     | 173.91          | 405.86     | (343.55)                 |
| 6       | Paid up Equity Share Capital  | 1,267.59      | 1,267.59   | 1,267.59        | 1,267.59   | 1,267.59                 |
| 7       | Other Equity  |               |            |                 |            | 9,271.71                 |
| 8       | Earnings Per Share of Rs.10/- each (for continuing and discontinued operations) -   |               |            |                 |            |                          |
|         | a) Basic  | 0.23          | 3.19       | 1.46            | 3.42       | (2.59)                   |
|         | b) Diluted  | 0.23          | 3.19       | 1.46            | 3.42       | (2.59)                   |

Notes:  
1. The above results were reviewed by the Audit Committee and then approved by the Board of Directors at their Meetings held on November 1, 2021. The information for the year ended March 31, 2021 presented above is extracted from the audited financial statements for the year ended March 31, 2021. These financial statements are prepared in accordance with the Indian Accounting Standards (IND AS) as prescribed under section 133 of the Companies Act, 2013.

2. The Board of Directors of the Company, being the Chief Operating Decision Maker ("CODM"), based on the internal business reporting system, identified that the Company has only one segment viz. manufacture and sale of Auto Component - Piston Rings, Differential Gears, Pole Wheel and other transmission Components. Accordingly there are no other reportable segments in terms of Ind AS 108 'Operating Segments'.

3. The outbreak of Coronavirus (COVID-19) pandemic globally and in India is causing significant disturbance and slowdown of economic activity. In such a situation, the Company has taken due care in concluding on accounting judgements and estimates; viz., in relation to recoverability of receivables, assessment of impairment of assets and inventory, based on the internal and external information available up to the date of approval of these financial results and expects to recover the carrying value of its assets. The actual impact of the global health pandemic may be different from that which has been estimated, as the COVID-19 situation evolves in India and globally. The Company continues to monitor the economic effects of the pandemic on the operations and take appropriate actions as and when required.

4. The previous period/year figures have been regrouped/reclassified wherever necessary to conform to current period/year classification.

For IP Rings Ltd.  
A. Venkataramani  
Managing Director

Place: Chennai  
Date: November 1, 2021

### NELCAST LIMITED

CIN: L27109AP1982PLC003518  
Regd. Office: 34, Industrial Estate, Gudur - 524 101. Tel: 08624 - 251266.  
Fax: 08624 - 252066. Website: www.nelcast.com Email: nelcast@nelcast.com

#### STATEMENT OF UN-AUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF-YEAR ENDED 30TH SEPTEMBER 2021

(₹ in lakhs)

| Sl. No. | Particulars   | Standalone     |            |                 | Consolidated   |            |                 |
|---------|---|----------------|------------|-----------------|----------------|------------|-----------------|
|         |   | 3 Months Ended |            | Half-Year Ended | 3 Months Ended |            | Half-Year Ended |
|         |   | 30.09.2021     | 30.06.2021 | 30.09.2020      | 30.09.2021     | 30.06.2021 | 30.09.2020      |
| 1       | Total Income from Operations  | 24202.15       | 18825.85   | 14065.31        | 43028.00       | 20738.83   | 61985.13        |
| 2       | Net Profit before tax from ordinary activities and Exceptional Items *      | 465.75         | 317.85     | 627.93          | 783.60         | -482.21    | 1228.79         |
| 3       | Net Profit after tax from ordinary activities and Exceptional Items *       | 336.42         | 202.50     | 466.57          | 538.92         | -373.50    | 904.18          |
| 4       | Total Comprehensive Income for the period after tax                         | 307.23         | 193.53     | 445.99          | 500.76         | -410.92    | 991.17          |
| 5       | Equity Share Capital (Face Value of Rs.2/- each fully paid up)              | 1740.02        | 1740.02    | 1740.02         | 1740.02        | 1740.02    | 1740.02         |
| 6       | Other Equity (as shown in the Audited Balance Sheet)                        |                |            |                 |                | 41269.46   | 41269.46        |
| 7       | Earnings Per Share of Rs.2/- each (EPS for the Quarters are not annualised) |                |            |                 |                |            |                 |
|         | Basic   | 0.39           | 0.23       | 0.54            | 0.62           | -0.43      | 1.04            |
|         | Diluted   | 0.39           | 0.23       | 0.54            | 0.62           | -0.43      | 1.04            |

Notes:  
The above is an extract of the detailed format of Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the Stock Exchange websites: [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com) and on the Company's website [www.nelcast.com](http://www.nelcast.com).

\* The Company does not have any Exceptional Items to report in the above periods.

For Nelcast Limited  
P. Deepak  
Managing Director

Place: Chennai  
Date: 01.11.2021

### SEL Manufacturing Company Limited

(CIN: L51909PB2000PLC023679)  
Regd. Office: 274, Dhandari Khurd, G.T. Road, Ludhiana 141 014.  
Ph.: +91-181-7111117, Fax: +91-161-7111118, website: www.selindia.in



CIAN HEALTHCARE LIMITED
Add: MILKAT NO.3339, BLOCK NO.1, FROM SOUTH SIDE, C.S. NO. 227/2+3A, HARPALE PARK, OPP. BERGER PAINT, PURSUNGI PUNE MH 412308 IN
NOTICE OF EGM, REMOTE E-VOTING AND DISPATCH OF NOTICE

ASTRAL LIMITED
(Formerly known as Astral Poly Technik Limited)
CIN : L25200GJ1996PLC029134
Regd. Office: "Astral House", 207/1, B/H. Rajpath Club, Off S.G. Highway, Ahmedabad-380 059, Gujarat, India

Atul Ltd
Registered office: Atul House, G I Patel Marg, Ahmedabad 380014, Gujarat, India
E-mail: shareholders@atul.co.in | Website: www.atul.co.in
Telephone: (+91 79) 26461294 | 26463706
Corporate identity number: L99999GJ1975PLC002859

POONAWALLA HOUSING
(અગાઉ મગ્મા હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ તરીકે જાણીતી)
કોર્પોરેટ ઓફીસ : ૬૦૨, શ્રી માળ, ઝીરો નં અર્થટી પાર્ક, સિરીયલ નં. ૦૮/૧, ઘોરપડી, મુંબવા રોડ, પુષ્કે-૪૧૧૦૩૬
૨૪૨૨૨૨ ઓફીસ : ૩૧૫૫૫૫૫૫ ૬૦૧૫૫, ૨૪ પાર્ક સ્ટ્રીટ, કોલકાતા-૭૦૦૦૧૬

Bank of India BOI
Head Office, Information Technology Department, Star House-2, 8th Floor, C-4, G-Block
Bandra-Kurla Complex, Bandra (E), Mumbai-400051.E-mail: Headoffice.it@bankofindia.co.in

OZONE WORLD LIMITED
Registered Office: 501/1, Parshwa, Opp. Rajpath Club, S. G. Highway, Bodakdev,
Ahmedabad - 380054 CIN : L65910GJ1989PLC012835 Phone No. 079 - 26873755
Fax No. 079 - 26871756 Website : www.ozoneworldindia.com

આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ
ફાઇનાન્સ સેક્ટરમાં સર્વોચ્ચ ગુણવત્તા અને ગ્રાહકોને શ્રેષ્ઠ સેવાઓ આપવાનો ઉદ્દેશ્ય રાખીને, અમારા સર્વિસ પ્રોવાઇડર તરીકે કાર્ય કરી રહ્યા છીએ.

પરિશિષ્ટ-૪-એ
(સિક્યોરીટી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સેવિંગ્સ નિયમોના નિયમ ૮ (દ)ની જોગવાઈઓ જુઓ)
સ્થાયર મિલકતોના વેચાણ માટે વેચાણ નોટિસ

આ નોટિસને ઉપર જણાવેલ તારીખ ના રોજ ઇ-સ્ટ્રાઇ વેચાણની યોજના અંગે ઉપર જણાવેલ લોનના દેવાદારો/જામીનદારોને સિક્યોરીટી ઇન્વેસ્ટમેન્ટ (એન્ડ સેવિંગ્સ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮ (દ) તરીકે પણ ગણવાની રહેશે. આથી દેવાદાર(રો) / જામીનદાર(રો) અને ગીરવેદાર(રો)ને આ નોટિસ પ્રસિદ્ધ થયાની તારીખથી ૧૫ દિવસની અંદર ઉપર જણાવેલ રકમ ચૂકવવા જણાવવામાં આવે છે. જેમાં નિષ્ફળ જતાં, મિલકતની હરાજ/વેચાણ કરવામાં આવશે અને બાકી રકમ, જે કોઈ હોત તો વ્યાજ અને પચ્ચં સહીત ચૂકવવામાં આવશે.

DECO MICA LIMITED
Regd. Office : 306, 3rd Floor, Iscon Mall, Star Bazar Building, Jodhpur Char Rasta, Ahmedabad - 380015
CIN No : L20299GJ1988PLC010807

LOYAL equipments limited
(CIN : L29190GJ2007PLC050607)
Regd. Office: Block No. 35/1-2-3-4, Village-Zak, Dahegam, Gandhinagar-382330, Gujarat, India. Tel No. : +91-2718-247236, Fax No. : +91-2718-269033

RATNABHUMI DEVELOPERS LIMITED
CIN: L45200GJ2006PLC848776
Regd. Office: S.F. 207, Turquoise, Panchvati Panch Rasta, Nr. White House E.B., C.G. Road, Ahmedabad-380009, Gujarat, India • Tel No. : (079) 40056129

Extract of Unaudited Consolidated Financial Results for the Quarter and Half Year ended on 30th September, 2021 (Rupees in Lakhs)

SBI ભારતીય સ્ટેટ બેંક
મુખ્ય મથક શાખા - ૦૮૦૫૩
દરારી નોટિસ
વ્યાજવહી/શરતો જેમણે નીચે જણાવેલા ખાતાઓમાં અમારી પાસેથી રોજના ના દરારીઓ ગીરવે મૂકી ગોલ્ડ લોન મેળવી હતી તેઓ પૈકીના સુધારામાં સહયોગ આપવા અંગે આપનો સહયોગ જરૂર પડે છે.

એક્સપ્રેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ માટે આમંત્રણ
(દરારીઓની સાથે ઇન્વેસ્ટમેન્ટ માટે સહયોગ આપવાનો આમંત્રણ)
નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮ (દ)ની જોગવાઈઓ

સંબંધિત વિગતો
સિક્યોરીટી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સેવિંગ્સ નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮ (દ)ની જોગવાઈઓ જુઓ

HESTER
સીઆઈએન : L99999GJ1987PLCO22333
૨૪૨૨૨૨ ઓફીસ : પલ્લવે માળ, "પુષ્પક", પંચવટી ચાર રસ્તા, મોતીલાલ હિરાભાઈ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૬, ગુજરાત. ફોન : +૯૧-૭૯૨૨-૬૪૪૧૧૦૬ ફેક્સ : +૯૧-૭૯૨૨-૬૪૪૧૧૦૫
ઈ-મેલ : mail@hester.in વેબસાઈટ : www.hester.in